

Ref: MIL/BSE/2023 Date: 27.05.2023

To,

The Corporate Relations department **Bombay Stock Exchange Limited**Department of Corporate Services
P J Towers, Dalal Street, Fort,
Mumbai-400001.

**Re: Maximus International Limited** 

Script Code: 540401

Subject: Publication of Extract of Audited Financial Results for the Fourth Quarter and Financial

Year ended 31st March, 2023 in Newspapers

Ref: Regulation 30 and 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements)

Regulations, 2015, as amended from time to time.

Dear Sir/Madam,

Please find enclosed herewith copies of the extract of Audited Financial Results of the Company for the Fourth Quarter and Financial Year ended 31<sup>st</sup> March, 2023, on Consolidated basis, published in Business Standard, English language newspaper (having Nationwide Circulation) and Loksatta Jansatta (Regional language newspaper) at Vadodara, Gujarat on 27<sup>th</sup> May, 2023.

The above information is also available on the Company's website at <a href="https://www.maximusinternational.in">www.maximusinternational.in</a>.

Kindly take the above information on your record.

Thanking you,

Yours faithfully,

FOR: MAXIMUS INTERNATIONAL LIMITED

DHARATI
DARPAN
BHAVSAR
BHAVSAR
Digitally signed by DHARATI DARPAN
BHAVSAR
Date: 2023.05.27
14:48:36 +05'30'

Dharati Bhavsar Company Secretary

Encl: as above

#### **MAXIMUS INTERNATIONAL LIMITED**

Regd. Office: Plot No. B-12 to B-15, Phase II, MEPZ-SEZ, Tambaram,

Chennai - 600 045, India. Phone No: +91-44-42298199.

E-mail: investorservices@igarashimotors.co.in, Website: www.igarashimotors.com CIN: L29142TN1992PLC021997

#### Extract of audited financial results for the quarter and year ended 31 March 2023

			Quarter ended		Year ended	
SI	Particulars	31-Mar-2023 31-Dec-2022 31-Mar-2022 3		31-Mar-2023	31-Mar-2022	
No.	Particulars	(Audited) Refer Note (a)	(unaudited)	(Audited) Refer Note (a)	(Audited)	(Audited)
1	Revenue from operations	17,292.64	16,697.72	13,782.20	65,624.58	55,640.46
2	Profit / (loss) before tax	1,007.89	388.35	(420.25)	910.12	231.42
3	Profit / (loss) for the period	763.16	134.34	(328.10)	523.77	119.00
4	Total comprehensive income for the period / year	938.45	113.30	(362.41)	125.14	412.90
5	Paid up equity share capital (Face value of Rs. 10 each)	3,147.50	3,147.50	3,147.50	3,147.50	3,147.50
6	Earnings per share (Rs.)					
	(Not annualised in the quarters)					
	(i) Basic	2.42	0.43	-1.04	1.66	0.38
	(ii) Diluted	2.42	0.43	-1.04	1.66	0.38

Notes to the Financial Results for the quarter and year ended 31 March 2023:

- a. The audited financial results for the quarter and year ended 31 March 2023 has been reviewed by the Audit Committee at its meeting held on 25 May 2023 and approved at the meeting of the Board of Directors held on that date. The above results have been subjected to audit by the Statutory auditors of the Company. The report of the statutory auditor is unqualified. The figures for the quarter ended 31 March 2023 and 31 March 2022 are the balancing figures between audited figures in respect of the full financial years and the published unaudited year to date figures up to the end of the third quarter of the relevant financial year, which were subjected to limited review and were not subjected to audit.
- b. These financial results have been prepared in accordance with Indian Accounting Standards ("Ind AS") prescribed under Section 133 of the Companies Act, 2013 and other accounting principles generally accepted in India and in terms of Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.
- c. On 25 May 2023, the Board of Directors have recommended a final dividend of Rs. 1/- per share for the financial year ended 31 March 2023, subject to the approval of the shareholders in the ensuing Annual General Meeting.
- d. The full financial results are available on the Bombay Stock Exchange website (www.bseindia.com), the National Stock Exchange website (www.nseindia.com) and on the Company's website (www.igarashimotors.com)

For Igarashi Motors India Limited R Chandrasekaran

Place: Chennai **Managing Director** Date: 25 May 2023 DIN: 00012643



# MAXIMUS INTERNATIONAL

**Increase in Sales** 



Increase in EBITA



**Increase in PAT** 



#### **EXTRACT OF STATEMENT OF CONSOLIDATED AUDITED FINANCIAL RESULTS** FOR THE QUARTER AND YEAR ENDED 31ST MARCH, 2023

(₹ in Lakhs)

(a) Basic (Rs.)

(b) Diluted (Rs.

Place : Gurugram

Date: 25 May 2023

				CONSOLIDATED	CONSOLIDATED							
Sr.	Particulars		<b>QUARTER ENDED</b>		YEAR E	ENDED						
No.	r at tibutat 3	31.03.2023 (Audited)	31.12.2022 (Unaudited)	31.03.2022 (Audited)	31.03.2023 (Audited)	31.03.2022 (Audited)						
1	Total Income from operations (Net)	2,344.78	2,478.32	1,958.47	10,128.14	7,042.14						
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/ or Extraordinary items)	145.14	175.54	153.63	790.39	515.24						
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	145.14	175.54	153.63	790.39	515.24						
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	133.95	177.64	137.48	728.78	466.35						
5	Total Comprehensive Income for the period	110.47	174.53	159.12	778.49	534.95						
6	Equity Share Capital (Face Value ₹1/- per share)	1,257.20	1,257.20	1,257.20	1,257.20	1,257.20						
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	1948.51	1353.83						
8	Earnings Per Equity Share on net profit after tax (Fully paid- up equity share of ₹1/- each)											
	1. Basic (₹)	0.11	0.14	0.10	0.55	0.34						
	2. Diluted (₹)	0.11	0.14	0.10	0.55	0.34						

Notes: 1. Key numbers of Audited Standalone Financial Results

(₹ in Lakhs)

Deepak V Raval

	(* 111 - 111						
		STANDALONE					
Sr.	Particulars		QUARTER ENDED	YEAR ENDED			
No.	Failiculais	31.03.2023 (Audited)	31.12.2022 (Unaudited)	31.03.2022 (Audited)	31.03.2023 (Audited)	31.03.2022 (Audited)	
1	Turnover (Revenue from operations)	64.83	675.42	19.37	1769.07	429.58	
2	Profit Before Tax	(14.24)	18.20	(17.33)	69.14	(20.73)	
3	Profit After Tax	(11.85)	18.96	(17.71)	55.49	(22.27)	

(In above table, brackets denotes negative figures)

2. The said results have been reviewed by the Audit Committee and approved by the Board of Diretors of the Company at its Meeting held on 25th May, 2023.

3. The above is an extract of the Audited Financial Results filed with the Stock Exchange. The detailed Financial Results are available on the Company's website at www.maximusinternational.in and the Stock Exchange's website at www.bseindia.com

For Maximus International Limited Sd/-

(Chairman & Managing Director)

Date: 25th May, 2023

Place: Vadodara

SMS reachbs to 57575 or email us at order@bsmail.in

To book your copy,

Business Standard Insight Out

Balmer Laurie & Co. Ltd.

A Government of India Enterprise)

SBU: Chemicals

Regd. Office: 21, N S Road, Kolkata – 700 001, Works: 32 Sattangadu Village, Manali, Chennai - 600 068

CIN: L15492WB1924G01004835, Website: www.balmerlawrie.com

Balmer Lawrie invites bids against the following tenders. For online bid please visit e-proc site: https://balmerlawrle.eproc.ln. All the revisions to the subject tenders shall be hosted on Balmer Lawrie selves updated. For any quer

websites only. Bidders should regularly visit these websites to keep themselves updated. F please contact: Ms.T. Indhira, Sr. Manager (SCM). Ph: +91 44 25946564, email: Indhira.t@balmerta DUE DATE TENDER NO. PRODUCT BL/LC/MAN/TSC/LT/202324/0052 Support Services for Technical Service Centres

\*Sulphone based Syntans \*Melamine Syntan
\*Mimosa Hydrogenated Palm Sterine \*Casein \*Nitro
Cellulose \*DI ISO BUTYL KETONE \*Lauryl Alcoholo
30.06.2023
\*Alfa Olefins Sulphonate \*Linear Alfa Olefins
\*DI OCTYL SULPHO SUCCINATE \*Vegetable Wax

(INR in lakhs execpt per share data)

102 84

102.84

(12.03)

(12.03)



parties send email

Regd. Office: Jai Kisaan Bhawan, Zuarinagar, Goa - 403 726, CIN - L65921GA1967PLC000157 Telephone: (0832) 2592181, 2592182; Website: www.adventz.com Email: ig.zgl@adventz.com Extract of Statement of Audited Consolidated Financial Results for the Quarter and Year ended 31 March 2023

Quarter Ended Quarter ended Quarter ended Year ended 31/03/2023 (Audited) 31/12/2022 (Un-Audited) (Audited) Total Revenue from operations 28,215.88 25,222,75 25,626.62 95,513.50 72,182,74 Net Profit/ (Loss) for the period (before Tax, Exceptional 11.799.76 (2,348.54) 31,375,29 (4,455,26) and / or Extraordinary Items) 4.511.62 Net Profit/(Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary Items) 11,799.76 (2.348.54)4.511.62 31,375.29 (4,455.26)Net Profit/(Loss) for the period after tax (after Exceptiona 4 10,114.11 (398.70)3,526.06 30,512.78 (3,477.46)5 Total Comprehensive Income/ (Loss) for the period [comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income/ (Loss) (after tax)] (4,503.30) 18,372.66 (29, 140.89)(87,600.76) (1,08,048.05)6 Paid up Equity Share Capital (Face Value of Rs.10/- each) 2,978.17 2,978.17 2,944.11 2,978.17 2,944.1 Other Equity as per balance sheet of previous accounting year 2.36.519.19 2,94,408.32 Earnings Per Share (of Rs. 10/- each) (for continuing operation) (not annualised)

1. The above Audited Consolidated Financial Results have been reviewed by the Audit Committee at the meeting held on 25 May 2023 and thereafter approved by the Board of Directors in the meeting held on 25 May 2023.

(1.26)

(1.26)

11.98

11.98

33 99

33.99

2. The Board of Directors of the Company at its meeting held on 25 May 2023, recommended a Final Dividend on 10.5% and 7% Non-Convertible Redeemable Preference Shareholders ("NCRPS") and Equity Shares of the Company for the Financial Year 2022-23 in the manner as follows: (a) Dividend@ 10.5% i.e., Rs.1.05/- per NCRPS on 58,52,034 NCRPS of the face value of Rs.10/- each; (b) Dividend @ 7% i.e., Rs.0.70/- per NCRPS on 59,22,080 NCRPS of the face value of Rs.10/- each (c) Dividend @ 10% i.e., Rs.1 per Equity Share on 2,97,81,184 Equity Shares of the face value of Rs.10/- each.

3. Additional Information pursuant to Regulation 47(1) (b) of the SEBI (LODR) Regulations, 2015 on Key Standalone Audited financial information of the Company is given below

SI. No	Particulars	Quarter ended 31/03/2023 (Audited)	Year ended 31/03/2023 (Audited)	Quarter ended 31/03/2022 (Audited)
1	Total Revenue from operations	27,325.22	81,195.52	19,007.33
2	Profit before Tax	7,232.76	2,479.08	5,742.77
3	Profit after Tax	5,569.37	1,836.91	4,511.56

4. The above is an extract of the detailed format of Financial Results filed with Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the financial results for the Quarter ended March 31, 2023 are available on the Stock Exchange websites, www.bseindia.com/www.nseindia.com and the Company's website www.adventz.com.

5. Consequent to amalgamation of Gobind Sugar Mills Limited (GSML) with Zuari Industries Limited ("ZIL/the Company") (formerly Zuari Global Limited), the Company had accounted for the amalgamation using the pooling of interest method from the appointed date i. e. 1 April 2020 as prescribed in Ind AS 103 - "Business Combinations". The previous periods' figures in both standalone and consolidated results have accordingly been restated. The equity shares issued pursuant to the scheme of amalgamation have been considered in both basic and diluted EPS for all

6. The Board of Directors of the Company vide its resolution dated 13 February 2023 had accorded its consent for the Scheme of Amalgamation between the Company and Zuari Sugar & Power Limited (a wholly owned subsidiary company) and their respective shareholders and creditors ('the Scheme'). The Board of Directors of the Zuari Sugar & Power Limited have also accorded consent to the Scheme vide their resolution dated 31 January 2023. The appointed date of Amalgamation as per the Scheme is 1 April 2022. Further to the application filed with National Company Law Tribunal, Mumbai Bench ('NCLT'), NCLT vide its Order released on its website on 19 May 2023, has dispensed with the meeting of shareholders and creditors and directed to serve notices to applicable regulatory authorities as a part of the NCLT process.

7. The figures of the last quarter of the current year and of the previous year are the balancing figures between the audited figures for the full financia year and the published year to date figures upto third quarter of the respective financial years.

For and on behalf of the Board of Directors of Zuari Industries Limited (Formerly Zuari Global Limited)

Athar Shahab Managing Director DIN:01824891

GREEN

(in INR million)

## SYNERGY GREEN INDUSTRIES LIMITED

CIN: L27100PN2010PLC137493 392, E Ward, Shahupuri, Assembly Road, Kolhapur - 416001. Tel: (0231) 2658375 Email: nmm@synergygreenind.com

Website: www.synergygreenind.com **Extract of Audited Financial Results** 

for the quarter and year ended 31st March 2023

(Rs. In Lakhs except earning per share data) **Quarter Ended** Year Ended Sr **Particulars** 31.03.2023 31.12.2022 31.03.2022 31.03.2023 31.03.2022 No (Audited) (Unaudited) (Audited) (Audited) (Audited) Total income from operations 6.789.90 28.491.69 8.533.62 8.246.82 29.014.83 Net Profit / (Loss) for the period 458.60 -71.14 361.80 69.29 306.63 (before Tax and Exceptional items) Net Profit /( Loss) for the period 458.60 -71.14 361.80 69.29 306.63 before tax (after Exceptional items Net Profit / (Loss) for the period 343.08 -72.22 142.82 191.92 86.74 after tax (after Exceptional items) 5 Total Comprehensive Income for 360.23 -75.23 181.07 94.86 114.63 the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)] **Equity Share Capital** 1,413.00 1,413.00 1,413.00 1,413.00 1,413.00 2,003.38 2,098.22 Other equity excluding Revaluation Reserves 2.43 -0.51 Earnings Per Share 1.36 0.61 1.01 (of Rs. 10/-each) (for Continuing and discontinued of operations) 1. Basic: 2. Diluted :

## Notes:

- The above audited financial results have been reviewed by the Audit Committee and subsequently approved by the Board of Directors of the Company at their respective meetings held on May 26, 2023.
- The audit as required under Regulation 33 of SEBI (LODR) Regulations, 2015 has been completed by the Auditors of the Company.
- The above is an extract of the detailed format of audited Financial Results for the quarter and year ended March 31, 2023 filed with the stock Exchange under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended. The full formats of Audited financial results are available on the Stock Exchange of BSE at www.bseindia.com, NSE at www.nseindia.com and on company's website at www.synergygreenind.com.

For and on behalf of the Board of Directors

Sd/-

Sachin R. Shirgaokar **Chairman & Managing Director** DIN:00254442

### ŠKODA Auto Volkswagen India Private Limited (Formerly known as Volkswagen India Private Limited)

Registered office:E-1, MIDC Industrial Area Phase III, Nigoje Mhalunge, Kharabwadi, Chakan, Khed, Pune, Maharashtra, 410501 CIN: U70102PN2007FTC133117; T: +91 02135 61000 / 331000 F: +91 02135 661049

Email id: anoopkumar.pillai@skoda-vw.co.in Website: www.skoda-vw.co.in STATEMENT OF AUDITED FINANCIAL RESULTS FOR THE OUARTER ENDED AND YEAR ENDED MARCH 31, 2023

			Quarter Ende	d	Year	ended	
Sr. No.	Particulars	March 31, 2023	Dec 31, 2022	March 31, 2022	March 31, 2023	March 31, 2022	
		(Audited) Refer note 3	(Unaudited) Refer note 3	(Audited) Refer note 4	(Audited)	(Audited)	
1	Total Income from Operations	48,445.99	52,912.28	43,585.50	185,098.13	138,390.76	
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	4,499.94	2,744.66	1,055.35	7,624.11	2,984.49	
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	4,499.94	2,744.66	1,847.13	7,624.11	3,885.29	
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	2,138.07	1,074.17	1,823.36	3,094.99	2,083.40	
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	1,482.99	(2,462.45)	2,096.98	860.67	3,268.00	
6	Paid-up equity share capital (Face Value R. 10 each)	7,240.45	7,240.45	7,240.45	7,240.45	7,240.45	
7	Reserves (excluding Revaluation Reserves)	42,363.98	40,881.00	41,503.32	42,363.98	41,503.32	
8	Securities Premium Account	5,930.83	5,930.84	5,930.84	5,930.83	5,930.84	
9	Net Worth	49,604.43	48,121.45	48,743.77	49,604.43	48,743.77	
10	Paid up Debt Capital / Outstanding Debt	NA	NA	NA	NA	NA	
11	Outstanding Redeemable Preference Shares (Number of shares)	971,724,552	971,724,552	971,724,552	971,724,552	971,724,552	
12	Debt Equity Ratio	0.53	0.45	0.46	0.53	0.46	
13	Earnings Per Share in Rupees - Basic & Diluted :	2.95	1.48	2.52	4.27	2.88	
14	Category 'A' Equity Shares	222,420,477	222,420,477	222,420,477	222,420,477	222,420,477	
15	Category 'B' Equity Shares	501,625,161	501,625,161	501,625,161	501,625,161	501,625,161	
16	Capital Redemption Reserve	1,858.04	1,858.04	1,858.04	1,858.04	1,858.04	
17	Debenture Redemption Reserve	NA	NA	NA	NA	NA	
18	Debt Service Coverage Ratio	0.23	0.26	0.32	0.66	E//2005	
19	Interest Service Coverage Ratio	10.55	7.62	4.92	4.31	3.98	

## Notes:

Date: May 26, 2023

- These financial results of the Company have been prepared in accordance with the recognition and measurement principles laid down in Indian Accounting Standard 34, (Ind AS 34) "Interim Financial Reporting" prescribed under Section 133 of the Companies Act, 2013 as amended, read with relevant rules issued thereunder and other accounting principles generally accepted in India and in compliance with Regulation 52 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended.
- The above is an extract of the detailed format of unaudited financial results filed with the Stock Exchanges under Regulation 52 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the unaudited financial results are available on the websites of the Stock Exchange www.bseindia.com and on the Company's
- These Audited financial results have been reviewed and approved by the Board of Directors at its meeting held on May 26, 2023. The results for the year ended March 31, 2023 have been subjected to limited review by the Statutory Auditors of the Company.

For and on behalf of the Board of Directors

sd/-Pivush Arora Managing Director

DIN: 06991008

























Place: Kolhapur

Dated: 26.05.2023







Regd. Office: Plot No. B-12 to B-15, Phase II, MEPZ-SEZ, Tambaram,

Chennai - 600 045, India. Phone No: +91-44-42298199.

E-mail: investorservices@igarashimotors.co.in, Website: www.igarashimotors.com CIN: L29142TN1992PLC021997

#### Extract of audited financial results for the guarter and year ended 31 March 2023

			Quarter ended	Year ended		
SI	Particulars	31-Mar-2023	31-Dec-2022	31-Mar-2022	31-Mar-2023	31-Mar-2022
No.	raruculars	(Audited) Refer Note (a)	(unaudited)	(Audited) Refer Note (a)	(Audited)	(Audited)
1	Revenue from operations	17,292.64	16,697.72	13,782.20	65,624.58	55,640.46
2	Profit / (loss) before tax	1,007.89	388.35	(420.25)	910.12	231.42
3	Profit / (loss) for the period	763.16	134.34	(328.10)	523.77	119.00
4	Total comprehensive income for the period / year	938.45	113.30	(362.41)	125.14	412.90
5	Paid up equity share capital (Face value of Rs. 10 each)	3,147.50	3,147.50	3,147.50	3,147.50	3,147.50
6	Earnings per share (Rs.)		100	*	2	
	(Not annualised in the quarters)					
	(i) Basic	2.42	0.43	-1.04	1.66	0.38
	(ii) Diluted	2.42	0.43	-1.04	1.66	0.38

Notes to the Financial Results for the quarter and year ended 31 March 2023:

- a. The audited financial results for the quarter and year ended 31 March 2023 has been reviewed by the Audit Committee at its meeting held on 25 May 2023 and approved at the meeting of the Board of Directors held on that date. The above results have been subjected to audit by the Statutory auditors of the Company. The report of the statutory auditor is unqualified. The figures for the quarter ended 31 March 2023 and 31 March 2022 are the balancing figures between audited figures in respect of the full financial years and the published unaudited year to date figures up to the end of the third quarter of the relevant financial year, which were subjected to limited review and were not subjected to audit.
- b. These financial results have been prepared in accordance with Indian Accounting Standards ('Ind AS') prescribed under Section 133 of the Companies Act, 2013 and other accounting principles generally accepted in India and in terms of Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.
- c. On 25 May 2023, the Board of Directors have recommended a final dividend of Rs. 1/- per share for the financial year ended 31 March 2023, subject to the approval of the shareholders in the ensuing Annual General Meeting.
- d. The full financial results are available on the Bombay Stock Exchange website (www.bseindia.com), the National Stock Exchange website (www.nseindia.com) and on the Company's website (www.igarashimotors.com)

For Igarashi Motors India Limited

R Chandrasekaran **Managing Director** DIN: 00012643



Place: Chennai

Date: 25 May 2023

# MAXIMUS INTERNATIONAL

**Increase in Sales** 



Increase in EBITA



**Increase in PAT** 



#### **EXTRACT OF STATEMENT OF CONSOLIDATED AUDITED FINANCIAL RESULTS** FOR THE QUARTER AND YEAR ENDED 31ST MARCH, 2023

(₹ in Lakhs) CONSOLIDATED YEAR ENDED **QUARTER ENDED Particulars** 31.03.2023 31.12.2022 31.03.2022 31.03.2023 31.03.2022

		(Audited)	(Unaudited)	(Audited)	(Audited)	(Audited)
1	Total Income from operations (Net)	2,344.78	2,478.32	1,958.47	10,128.14	7,042.14
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/ or Extraordinary items)	145.14	175.54	153.63	790.39	515.24
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	145.14	175.54	153.63	790.39	515.24
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	133.95	177.64	137.48	728.78	466.35
5	Total Comprehensive Income for the period	110.47	174.53	159.12	778.49	534.95
6	Equity Share Capital (Face Value ₹1/- per share)	1,257.20	1,257.20	1,257.20	1,257.20	1,257.20
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-		1948.51	1353.83
8	Earnings Per Equity Share on net profit after tax (Fully paid- up equity share of ₹1/- each)					
	1. Basic (₹)	0.11	0.14	0.10	0.55	0.34
	2. Diluted (₹)	0.11	0.14	0.10	0.55	0.34
Note	S:					(# i= 1 = i+=)

1. Key numbers of Audited Standalone Financial Results

(₹ in Lakhs

Place : Gurugram

Date: 25 May 2023

ı			STANDALONE							
ı	Sr.	Particulars		QUARTER ENDED	YEAR ENDED					
	No.	railivulais	31.03.2023 (Audited)	31.12.2022 (Unaudited)	31.03.2022 (Audited)	31.03.2023 (Audited)	ENDED 31.03.2022 (Audited)			
	1	Turnover (Revenue from operations)	64.83	675.42	19.37	1769.07	429.58			
	2	Profit Before Tax	(14.24)	18.20	(17.33)	69.14	(20.73)			
[	3	Profit After Tax	(11.85)	18.96	(17.71)	55.49	(22.27)			
	(In	shove table, brackets denotes possible figures)								

2. The said results have been reviewed by the Audit Committee and approved by the Board of Diretors of the Company at its Meeting held on 25th May, 2023.

3. The above is an extract of the Audited Financial Results filed with the Stock Exchange. The detailed Financial Results are available on the Company's website at www.maximusinternational.in and the Stock Exchange's website at www.bseindia.com.

For Maximus International Limited Sd/-Deepak V Raval

(Chairman & Managing Director)

Date: 25th May, 2023

Place: Vadodara

ŠKODA Auto Volkswagen India Private Limited (Formerly known as Volkswagen India Private Limited)

Registered office:E-1, MIDC Industrial Area Phase III, Nigoje Mhalunge, Kharabwadi, Chakan, Khed, Pune, Maharashtra, 410501 CIN: U70102PN2007FTC133117; T: +91 02135 61000 / 331000 F: +91 02135 661049 Email id: anoopkumar.pillai@skoda-vw.co.in Website: www.skoda-vw.co.in

STATEMENT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED AND YEAR ENDED MARCH 31, 2023

	(in INR million)						
			Quarter Ende	d	Year	ended	
Sr. No.	Particulars	March 31, 2023	Dec 31, 2022	March 31, 2022	March 31, 2023	March 31, 2022	
		(Audited) Refer note 3	(Unaudited) Refer note 3	(Audited) Refer note 4	(Audited)	(Audited)	
1	Total Income from Operations	48,445.99	52,912.28	43,585.50	185,098.13	138,390.76	
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	4,499.94	2,744.66	1,055.35	7,624.11	2,984.49	
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	4,499.94	2,744.66	1,847.13	7,624.11	3,885.29	
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	2,138.07	1,074.17	1,823.36	3,094.99	2,083.40	
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	1,482.99	(2,462.45)	2,096.98	860.67	3,268.00	
6	Paid-up equity share capital (Face Value R. 10 each)	7,240.45	7,240.45	7,240.45	7,240.45	7,240.45	
7	Reserves (excluding Revaluation Reserves)	42,363.98	40,881.00	41,503.32	42,363.98	41,503.32	
8	Securities Premium Account	5,930.83	5,930.84	5,930.84	5,930.83	5,930.84	
9	Net Worth	49,604.43	48,121.45	48,743.77	49,604.43	48,743.77	
10	Paid up Debt Capital / Outstanding Debt	NA	NA	NA	NA	NA	
11	Outstanding Redeemable Preference Shares (Number of shares)	971,724,552	971,724,552	971,724,552	971,724,552	971,724,552	
12	Debt Equity Ratio	0.53	0.45	0.46	0.53	0.46	
13	Earnings Per Share in Rupees - Basic & Diluted :	2.95	1.48	2.52	4.27	2.88	
14	Category 'A' Equity Shares	222,420,477	222,420,477	222,420,477	222,420,477		
15	Category 'B' Equity Shares	501,625,161	501,625,161	501,625,161	501,625,161	501,625,161	
16	Capital Redemption Reserve	1,858.04	1,858.04	1,858.04	1,858.04	1,858.04	
17	Debenture Redemption Reserve	NA	NA	NA	NA	NA	
18	Debt Service Coverage Ratio	0.23	0.26	0.32	0.66	0.73	
19	Interest Service Coverage Ratio	10.55	7.62	4.92	4.31	3.98	

Notes:

- These financial results of the Company have been prepared in accordance with the recognition and measurement principles laid down in Indian Accounting Standard 34, (Ind AS 34) "Interim Financial Reporting" prescribed under Section 133 of the Companies Act, 2013 as amended, read with relevant rules issued thereunder and other accounting principles generally accepted in India and in compliance with Regulation 52 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended.
- The above is an extract of the detailed format of unaudited financial results filed with the Stock Exchanges under Regulation 52 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the unaudited financial results are available on the websites of the Stock Exchange www.bseindia.com and on the Company's
- These Audited financial results have been reviewed and approved by the Board of Directors at its meeting held on May 26, 2023. The results for the year ended March 31, 2023 have been subjected to limited review by the Statutory Auditors of the Company.

For and on behalf of the Board of Directors

sd/-Pivush Arora Managing Director

DIN: 06991008

To book your copy, SMS reachbs to 57575 or email us at order@bsmail.in

> Business Standard Insight Out

Balmer Lawrie & Co. Ltd.

A Government of India Enterprise)

SBU: Chemicals

Regd. Office: 21, N S Road, Kolkata – 700 001, Works: 32 Sattangadu Village, Manali, Chennai - 600 068

CIN: L15492WB1924G01004835, Website: www.balmerlawrle.com

Balmer Lawrie invites bids against the following tenders. For online bid please visit e-proc site: https://balmerlawrle.eproc.ln. All the revisions to the subject tenders shall be hosted on Balmer Lawrie

websites only. Bidders should regularly visit these websites to keep themselves updated. F please contact: Ms.T. Indhira, Sr. Manager (SCM). Ph: +91 44 25946564, email: Indhira.t@balmerta selves updated. For any quer DUE DATE TENDER NO. PRODUCT BL/LC/MAN/TSC/LT/202324/0052 Support Services for Technical Service Centres

\*Sulphone based Syntans \*Melamine Syntan
\*Mimosa Hydrogenated Palm Sterine \*Casein \*Nilto
Cellulose \*DI ISO BUTYL KETONE \*Lauryl Alcohol
Alfa Olefin Sulphonate \*Linear Alfa Olefins
\*DI OCTYL SULPHO SUCCINATE \*Vegetable Wax

adventz **ZUARI INDUSTRIES LIMITED** (FORMERLY ZUARI GLOBAL LIMITED)

parties send email

Regd. Office: Jai Kisaan Bhawan, Zuarinagar, Goa - 403 726, CIN - L65921GA1967PLC000157 Telephone: (0832) 2592181, 2592182; Website: www.adventz.com Email: ig.zgl@adventz.com Extract of Statement of Audited Consolidated Financial Results for the Quarter and Year ended 31 March 2023

	(ITTE III III.III O OLOGO PO IIIII O OLO							
SI. No	Particulars	Quarter Ended 31/03/2023 (Audited)	Quarter ended 31/12/2022 (Un-Audited)	Quarter ended 31/03/2022 (Audited)	Year ended 31/03/2023 (Audited)	Year ended 31/03/2022 (Audited)		
1	Total Revenue from operations	28,215.88	25,222.75	25,626.62	95,513.50	72,182.74		
2	Net Profit/ (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary Items)	11,799.76	(2,348.54)	4,511.62	31,375.29	(4,455.26)		
3	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary Items)	11,799.76	(2,348.54)	4,511.62	31,375.29	(4,455.26)		
4	Net Profit/(Loss) for the period after tax (after Exceptional Items)	10,114.11	(398.70)	3,526.06	30,512.78	(3,477.46)		
5	Total Comprehensive Income/ (Loss) for the period [comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income/ (Loss) (after tax)]	(29,140.89)	(4,503.30)	18,372.66	(87,600.76)	(1,08,048.05)		
6	Paid up Equity Share Capital (Face Value of Rs.10/- each)	2,978.17	2,978.17	2,944.11	2,978.17	2,944.11		
7	Other Equity as per balance sheet of previous accounting year	_	_		2,36,519.19	2,94,408.32		
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing operation) (not annualised)				_,_,,	_,_,		
	(a) Basic (Rs.)	33.99	(1.26)	11.98	102.84	(12.03)		
	(b) Diluted (Rs.)	33.99	(1.26)	11.98	102.84	(12.03)		

1. The above Audited Consolidated Financial Results have been reviewed by the Audit Committee at the meeting held on 25 May 2023 and thereafter approved by the Board of Directors in the meeting held on 25 May 2023.

2. The Board of Directors of the Company at its meeting held on 25 May 2023, recommended a Final Dividend on 10.5% and 7% Non-Convertible Redeemable 2. The Board of Directors of the Company at its meaning field of 12 May 2023, recommended a runal bividend of 10.5% and 7% Non-Conventible Redeemable Preference Shareholders ("NCRPS") and Equity Shares of the Company for the Financial Year 2022-23 in the manner as follows: (a) Dividend@ 10.5% i.e., Rs.1.05/- per NCRPS on 58,52,034 NCRPS of the face value of Rs.10/- each; (b) Dividend @ 7% i.e., Rs.0.70/- per NCRPS on 59,22,080 NCRPS of the face value of Rs.10/- each (c) Dividend @ 10% i.e., Rs.1 per Equity Share on 2,97,81,184 Equity Shares of the face value of Rs.10/- each.

3. Additional Information pursuant to Regulation 47(1) (b) of the SEBI (LODR) Regulations, 2015 on Key Standalone Audited financial information of the Company is given below

SI. No	Particulars	Quarter ended 31/03/2023 (Audited)	Year ended 31/03/2023 (Audited)	Quarter ended 31/03/2022 (Audited)
1	Total Revenue from operations	27,325.22	81,195.52	19,007.33
2	Profit before Tax	7,232.76	2,479.08	5,742.77
3	Profit after Tax	5,569.37	1,836.91	4,511.56

4. The above is an extract of the detailed format of Financial Results filed with Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the financial results for the Quarter ended March 31, 2023 are available on the Stock Exchange websites, www.bseindia.com/www.nseindia.com and the Company's website www.adventz.com.

5. Consequent to amalgamation of Gobind Sugar Mills Limited (GSML) with Zuari Industries Limited ("ZIL/the Company") (formerly Zuari Global Limited), the Company had accounted for the amalgamation using the pooling of interest method from the appointed date i. e. 1 April 2020 as prescribed in Ind AS 103 - "Business Combinations". The previous periods' figures in both standalone and consolidated results have accordingly been restated. The equity shares issued pursuant to the scheme of amalgamation have been considered in both basic and diluted EPS for all

6. The Board of Directors of the Company vide its resolution dated 13 February 2023 had accorded its consent for the Scheme of Amalgamation between the Company and Zuari Sugar & Power Limited (a wholly owned subsidiary company) and their respective shareholders and creditors ('the Scheme'). The Board of Directors of the Zuari Sugar & Power Limited have also accorded consent to the Scheme vide their resolution dated 31 January 2023. The appointed date of Amalgamation as per the Scheme is 1 April 2022. Further to the application filed with National Company Law Tribunal, Mumbai Bench ('NCLT'), NCLT vide its Order released on its website on 19 May 2023, has dispensed with the meeting of shareholders and creditors and directed to serve notices to applicable regulatory authorities as a part of the NCLT process.

7. The figures of the last quarter of the current year and of the previous year are the balancing figures between the audited figures for the full financia year and the published year to date figures upto third quarter of the respective financial years.

For and on behalf of the Board of Directors of Zuari Industries Limited (Formerly Zuari Global Limited)

**Athar Shahab** Managing Director DIN:01824891

GREEN

## SYNERGY GREEN INDUSTRIES LIMITED

CIN: L27100PN2010PLC137493 392, E Ward, Shahupuri, Assembly Road, Kolhapur - 416001. Tel: (0231) 2658375 Email: nmm@synergygreenind.com

Website: www.synergygreenind.com **Extract of Audited Financial Results** 

for the quarter and year ended 31st March 2023

	(Rs. In Lakhs except earning per share data)						
		G	Quarter Ende	d	Year	Ended	
Sr. No.	Particulars	31.03.2023	31.12.2022	31.03.2022	31.03.2023	31.03.2022	
511041091111		(Audited)	(Unaudited)	(Audited)	(Audited)	(Audited)	
1	Total income from operations	8,533.62	6,789.90	8,246.82	29,014.83	28,491.69	
2	Net Profit / (Loss) for the period (before Tax and Exceptional items)	458.60	-71.14	361.80	69.29	306.63	
3	Net Profit /( Loss) for the period before tax (after Exceptional items)	458.60	-71.14	361.80	69.29	306.63	
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional items)	343.08	-72.22	191.92	86.74	142.82	
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	360.23	-75.23	181.07	94.86	114.63	
6	Equity Share Capital	1,413.00	1,413.00	1,413.00	1,413.00	1,413.00	
7	Other equity excluding Revaluation Reserves	-	ī	1	2,098.22	2,003.38	
8	Earnings Per Share (of Rs. 10/-each) (for Continuing and discontinued of operations) 1. Basic: 2. Diluted:	2.43	-0.51	1.36	0.61	1.01	

- The above audited financial results have been reviewed by the Audit Committee and subsequently approved by the Board of Directors of the Company at their respective meetings held on May 26, 2023.
- The audit as required under Regulation 33 of SEBI (LODR) Regulations, 2015 has been
- completed by the Auditors of the Company. The above is an extract of the detailed format of audited Financial Results for the quarter and year ended March 31, 2023 filed with the stock Exchange under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended. The full formats of Audited financial results are available on the Stock Exchange of BSE at www.bseindia.com, NSE at www.nseindia.com and on company's website at www.synergygreenind.com.

For and on behalf of the Board of Directors

Sd/-

Sachin R. Shirgaokar **Chairman & Managing Director** DIN:00254442

Date: May 26, 2023

















Place: Kolhapur

Dated: 26.05.2023











સોનાના વાચદાના ભાવમાં રૂ.૧૧७ અને ચાંદીમાં રૂ.७૩૬ની વૃદ્ધિઃ નેચરલ ગેસ, મેન્થા તેલમાં ઢીલાશ



કોટન-ખાંડીના વાચદાના ભાવમાં 

ભાજપવાળા એવું વિચારી રહ્યા છે કે મારુ ધારાસભ્ય પદ કથારે જતું રહે, પણ એમનો કોઈ મેડ પડવાનો નથી: ધારાસભ્ય ચૈતર વસાવા



ાજપીલ્યાત.ce નમાંત્ર જિલ્લાના સારખસ તાલુકામાં આત્ર અંદમાં પાર્ટન સંગઠનો પીટીલ પોજારમાં સાથી હતી.દેખો દીધાવાડાના પારદાત્મ

મંગાનને પેટીંગ પોપાલાં સાથે તેને સ્વેતર, તમેંદ્ર કિલ્લા મામ સ્વાર્ટમાં પાર્ટીય તેને સ્વેતર, તમેંદ્ર કિલ્લા મામ મામને જ્યાર ક્લાઇને પાર્ટીય તારિત મેટી કેમ્પ્રેય કેમ્પ્રેય કરવા હતા. તારેક્રમ અભ્યાર્ગ કામ્પ્રેય કેમ્પ્રેય કેમ્પ્રેય કેમ્પ્રયું કેમ્પ્રેય કેમ્પ્રયું કેમ

દર તે તું ખામ ખાદથી પાર્ટીના કોઈ પણ કાર્યકાને પ્રશાસના પત્નથી કઈ મેચી તમાર છે, ખામપને આવનારી લોકાનમાં ચૂંટલીની બીંક છે.જુંબરે नमंद्र विकास अस्य अस्त्री पत्नी स

#### Housing.comએ ઓનલાઇન પ્રોપર્ટી સચેને મહત્ત્વ આપતા વડોદરામાં પ્રવેશ કર્યો વાલાં, દેશનાંજાઓ અને શ્રંપ



વાંડરા,તા રેજ ભારતના અસલી વિસ્તરન રિવા મેંસ્ટર પોરાશને Housing, ભારતમાં દિવા રેપો com ભારતમાં દિવાનો પાર્કેટ્સમાં શર નહીં કથાયેલી તહે પર મદાર સખતા ગુજરાતના વહેદસામાં નીપપાત પપર્શું ભરતા

માટે સાથ છે. આ વિકસતા પહોંદ્દસ પર ભૂઝડમાં કોઇસ સાથે, કેપમી હાલે પછીના ૧-૩ વર્ષ દિવસ ૧ Bosés éspéral votai માં મૃત દેવારેના મેન્યુના લોગ રેટ (સીએજાસાર) હોલલ કરવા માર્ચ છે, અને ને રીતે ક્રિક્ટલ

#### ઓસ્ટ્રેલીયામાં વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝાની સમસ્યા હશે તો ભારત સરકાર ચર્ચા કરશે : એસ.જયશંકર

રાજ્યોગવાના રક પરિસ્તંતથી વાત કરે છે અને વિદેશના કિન્દ્રીય વિદેશ મંત્રી અને નમોકા પણ લોકોને વ્યાનનું પરિસ્તંત ઇમાઈ જિલ્લા કાવારી કો.સુખલબખ હતું છે, બેલ. જ્યાંક પણ મું કે જ્યાંકર મેં દિવસીમ જોડા જિલ્લા ક્યાંકર મેં દિવસીમ જોડા જેવા નવ પરાંત્રો સલ્લાદ ની સ્તિયમ જમાદ એ દિવસીય નવાદ (1990) નુ પૂછા છે. છે. તે તેઓ પ્રાપ્ત દિવસે ત્રિયા નાદ તાલુકામાં સીકદ આદમેં વામ વેડવ્યા હેડવેલા ભાવન આત્મને પૂછા કર્યા હોંગીઓ ખાત ખુદૂર્ત કર્યું હતું અને પત્ર પંચાય કર્યા છે. વિદેશ માર્ચ એક પ્રાપ્ત માર્ચ અને પત્ર ક્રિયામાં પણ હિલ્લામાં પહેલા છે. ક્રિયામાં પણ હિલ્લામાં માર્ચ અને કર્યાલા કર્યા અને પત્ર અને (જાણાની માર્ચા કર્યાલા કર્યા અને પત્ર નેવા કર્યાલા કર્યા છે. તેઓ પ્રાપ્ત માર્ચ અને (જાણાની અન રાજ્યના કર્યા જ (૧૦૦૧ માર્ગી રહેવી સંજયદીની જત માહિતી રંજીથી છે.ગામ અંગાહવાડી અને સ્વાસ્થ્ય વર્ગક દેવાઓ પદ આદ્ર ગુદ્ધાનું છે.ડેલ્ટ્રેક એ પ્રાથમિક ભાર ખુશ્યું છે. છે. એ કે એ પાર્ચીકા જૂરિબિંગ છે. આજારીનું કરાયાન્ય સાર્ચ રહે માને ન્યૂરિબિંગ પણ રાયાવા સાર્ચ માર્ચ ખુલાક માર્ચ છે. એ અમાના મિક્ક માર્ચ ખુલાક રહે છે. એ અમાના મિક્ક પહેલો છે કે આત્રન આપાસી રેપ વર્ષોનો વિસ્તારિત દેશાની હોંગમાં બાદી વિદેશ મોત્રી એવા જન્માં છે. એ પ્રમાણ તે માર્ચ સાર્ચ કે પ્રમાણ કે ખુશ્યું છે. આ સાર્ચ મોર્ચ માર્ચ કર્યાને કે દિશા અભાગ માર્ચ કે ખુશ કે માર્ચ કે દિશા અભાગ માર્ચ કે ખુશ કરી છે.

પ્રાંથભાષોના ભાગ અમૃત દેશની ફ્લ આવાડી જેટલી વ્યક્તિઓને પ્રવેશ છે.૧૫ કરોડ દેશવાસીઓને પૂડી પૂડી લેશવાઓના સાથ આ સ્ટાકરે સાચા છે.છેલ્લા જર્મનું પરિવર્ષન મે આપ () ઉભા છ વાંતું પૈકિયન મેં ક્રિયા પ્રદેશના સાફાર્કને લોવું કરે તેનું પૈકિયને છે ત્યાં કરવા અને ક્રિયાનો પ્રદેશ જ જારાનોની મોટી સમાવાદી પ્રદેશ કરી તેને તેને જે પ્રાથમ કે આ ખાનને પોલ્ય કરી છું કાર્ય કિયા હીંમાને આખી વીંગત નહી. ક્રામાની મોટી સ્ટ્રેસન નહી. ક્રામાની મોટી સ્ટ્રેસન કર્યા કરવા છે. કરતા ક્રિયાનીઓ નિર્દેશ પ્રદેશ કરવા કરવા છે. કરતા ક્રિયાનીઓ નિર્દેશ પ્રદેશ કરવા કરવા છે. લાન વિદ્યાર્થીએ વિદે પણ તેઓએ પ્લાનનું કે તહેવી સમગ્રદને કોઈ પહેલા પાત પર આવી હતે. તહેવી મેને ખાત સરકાર અગિન પોત ઇંક્ટ સરકાર કરી તેમાં ભારતના પોતાને ક માર્ચ હતી કેમાં અને વિદ્યાર્થ કેમાં પાત વિદ્યાર્થ એ તેઓને વાલ્યાનું કેમાં પોતાને અને ઉપલાવ ન અને કોઈએ, તો પત્ર દેશામાં મિત્ર કરે હે પણ સમાનીનિયે પત્ર સીધા હોવી પેઈએ.

🗴 લોટર એન્ડ મેનીટેશન મેનેજ મેન્ડ ઓર્ચનાઇડેશન. 👌 સાંધીનગઢ સાંગીનગર જાતા પત્ર અને સ્વાપના એક્સ વારમાં – પંચાનતા પ્રસાદના વિસ્તા "વારને પત્ર" શહેર વિક્રિયાનો હતું, સ્વત્ર પ્રસાદન સ

an medical resources ુના મેન્ડિયારી, જાભાવામાં અને સ્વચ્છતા એકલ, કાઈય પાય, BSNL ક્લાઇસ, ક્લિમિલ લાઈન્સ ચેઠ, ગેંગરા - ૩૮૦૦૦૧, યોબાઈલ નં. ૧૯૦૮૮૪૪૨૦૦૦, વર્મમાં -પેમમાલલ કરા પેમમાલલ જાભાની મેળરા, એરલા (હ), શહેરા, કાલોલ, હાલોલ, લેવેલ્લા અને જોલુલોલ હાલુકાનાં ના ામાં કર્યુંથીઓ કેટીકામાં કોંગ્યું હેલ્લ એક્સિક્સની બેનિયાનીએ માહન નહેલ ૧૦૩ એક્સિક્સ અમાર સ્થાન કરેલે. દી કીમા કોંગ્યુંને રાજ્યન એ ઉ અપદા સ્થાન કેસ્સ કરવાના કરેલે. દી કીમા કોંગ્યુંને રાજ્યન એ ઉ www.sproote.com પર ઉપરામ, છે. તેના સ્વત્ય જૂ વિગને કર્યું જુઆરો કિસ્સને પાત્ર એન્સર્કન્સ હેલે. તેના સ્વત્ય જૂરી ઉ દેશાયા

નીયા - કોઈપણ દેન્દ્રત સ્વીકારણ કે દેન્કર પક કરવાની સતા યુનિક પૈનેજવાની, ભાજા અને સ્વયાન બેઠક, વેપાયાનની સ્ટીસે

જાના ૧૫ અને અપદાન અંદળ, પંચાયતાની અંદર. રહમ્મ તમાની પાણીપુરનાદ એ જનામી પાર્ટ રાજ્યા લાખે દિનસ રાત કેટ્ટી કરૂપ તાર્જનાઇ, જમારાંત કી તેમલ — ૧૯૧૮ ઉપર પાણી સમીચિત દિનસ સ્તૃતિન

(માહિતી/ગોધરા/૧૮૪/૧૩)

રિયા એક્ટેટ ઉદ્યોગમાં એક અદ્યંબારખાઇએક ઇક્કેક પર અથવી મેં માર્ડી વર્દીનો પોતાનો અથવાલા અને પ્રદેશ કરેટરાને સ્થિતિને પર માર્ચીય કરેટરાને સ્થિતિને પર માર્ચીય કરેટરાને સ્થિતિને પર માર્ચીય કરેટરાને સ્થિતિને પર માર્ચીય કરેટરાને એવા કે કે પ્રદેશના એવા કરે કરે કે પ્રદેશના પર માર્ચીય કરે કરે કે પ્રદેશના પર માર્ચીય કરે કે પ્રદેશના માર્ચ કે પ્રદેશના માર્ચ કે પ્રદેશના માર્ચ કરે કે પ્રદેશના માર્ચ કરે કે પ્રદેશના માર્ચ કે પ્રદેશના મ

	પશ્ચિમ રેલવે	) (I)	
-	annel squagaratio	HAP.	
	Education)		and the same
	piane bu dila omina erro		
med.		100	car/wait tree
110	मार्थ क्रिकेशन होते हैं। जीने मार्थकाल मार्थ क्रिकेश (N/H)	100.49	142-1011
100	mirati englishmidalization)	Apt with	adament
10.0	NSOSy 4.1-HELym miles at 2 het	17:46	street
	segge a position release de soli aliche	1000	afficient.
	(१५) १५ मोनी को से स्थानकर केरोस		1 4
	Many Services Edinates and Many Services		
100	standard with total and street star.	141	inguistra)
191	IF By to 10,570 to bott, any \$1,00. If will broughtful synapsics yet mea	110011	Manet
1589	DL dis-sel-diport	Limit	ideappe
1111	dis-obline-dose-tali	+4+	to getter.
926	(yearlie with tenance sites beautiful)	months	No. No. of Street
4 (544	Common and the design of their transferred in	TEXAS	ride state
103	when they depart softman in the debate	Francis:	NAME OF TAXABLE PARTY.
	ADSOLUTE AND AND AND AND AND ADDRESS OF THE ADDRESS		
170	LL LUBRIOUS AND SET WHEN ARREST	Mileria	tings (stat.)
4.010	TY COMPANY AND A STREET OF STREET	Street	tirpiosi.
110	DESTRUCTIONS, - PARKING HER PARKING	161	19/(9/81)
4.04	disoni meditorigilarinas	unis.	terpeions
1.04	THE REAL PROPERTY OF PERSONS AND ADDRESS OF THE PERSON ADDRESS OF THE PERSON AND ADDRESS OF THE PERSON ADDRESS OF	11044	(milliont)
Tiest	nite tid. Deignald in a ceite	10.00	11/2/1011
100	in introduceral and minimpeda	timin	10:35-1501
-	wales ska		
1700	anden.	stovin.	Targo-chest
1116	त्या विकास प्रदेश स्थित है है जिसके स्थित है । बोर्डिश प्रदर्शन के बोर्डिश करें प्रदेश के प्रदेश करती करती कर्म	Hì	(c-fe)att
111	No fill the mannered to	380	10/201511
111	-philodopa	1148	19/20/2011
114	Charlesorbeil	100Actie	Appearer:
112	distinguishing.	KNOP46	targethis
11%	ter moved wheat the die	Service	Starte States
114	E-E-E-Vours	1112-91	may hard
114	GROUPE AL RESOLUTION ALTHOUGH	1148	arquout.
	Children et a minimum (expendición)	770-	in the second
	मार्थ की बहुत्वर मान्य प्रमान स्थित होति है करिया है जिल		
	Anti-marks sout (-) Shoult in the Page sold		TO 1 10
110	esse picker i Francis i Francis granullere	inne	inquisi:
	नामक का दिन को है। को का नाम की का बार्ट क		2000
	after and sugfores and your		
110	vioring the probability of the confidence of	Appreis.	arge (state
	matth drawingled driven allowand		
	Danish of sanding boars		
	and service		
118	CRIME IN IN HERMAN	1111-15	andage out
113	ed similia miserativa	races	or year out
1.17		- Augusti	- den err
111	describbiographics	18081	requires
111	sinequality-ther	talenth	21 gas 2142
11.0	material varieties del directors	1025	or qual-town
-	LECTED IN COLUMN	Control of	Total Section Straight
12	Martin ogici arel, medit.		negation.
	victories had be with a jew but visco.		- Constant
	will final space to a year or a review		
-	110000154.464		3000
151	Tares George Sayra Pasceri Fears.	1915	te/pissii
	graf, servi, sitrapol, disaffor		
11	grandle-mailtegfer-au, 6%	9100-FS	18991500
12	tel 60	419419	-a-finish-
11	doctored protein a rome	traviti	11125-2011

પ્રવસોની ખાવલે કરી હતી. વલકો અને આતરદીર વિશે રિપ્પન્ની કરતા, Housing. come રિસર્સ વડા, દુ. અંક્રિય સુદ્ર એ જણાવ્યું કે વાંદિરા ગુજરાતના જુન્ય પ્રોપર્ટી અજારીમાંના એક ત્રસોકે ઉપસી રહ્યું છે."

ખતેક શેર્સ દેખા પણવે છે. ખા પાંદળીમાં માર્ચી કે બીએપહેલાના માર્ચની તોથી વધુ થાય છે, દુંખાં હો દરામાં ફેખ્ય દેખાં હોન્સ દાખાં છે. વધુમાં, શકે તેમાં યોખર્ક ભાગી આ પોર્ચીની નામ દુંખા કર્યા કર્યા કે કરો કરો છે. હો દરમાં વિશ્વ એક્ટર્સ દેખામાં તમે મોર્ચી કે આંકાર્ડિયાં થયો Housing.comની ચીંત-ચેન્ડ-સીંદ હિંત-ફુંખાં માર્ચ શર્મ સામાં હા કુંખાં પ્રદેશના દોષી આ થ્રી દિવા નામદેદ ખેલામાં કરોયી આ થ્રી દિવા નામદેદ ખેલામાં કરોયી આ થ્રી દિવા નામદેદ ખેલામાં Chemcon Speciality Chemicals Limited
(AN ISO 0001 2015 and ISO 14501 2015 Cheffield Campony)
https://doi.org/10.1001/1

BEATERBAT OF ALDITED FINANCIAL RESILENCEON THE CONSTER AND YEAR ENDED WARCH IN JUST વારા માર્ચા હતી, તેમણે કોર્મથી કેટવર્ક સુધીની ગાહિતી અને તાંતરદરિતી, નહિનલ ઉદ્યોગ

પશ્ચિમ રેલ્લો-લાક્સ્સ ક્રિક્ટિંગન

That score has operated that PS (Close) for the pareal cyclose Tax, Exceptional and/or Extraorchisty Berral Not Pictor (Cose) for the pareal before the 1,00072 19220 23408 13534 6380 | Well-William for the period when the other General and the Extending American V Net Professional for the period of the tax. (Net Professional for the period of the tax.) (Net Professional for the Computers, forms) of the Computers in terms (of the jump) and of the Computers with internet (of the facility of the Computers with internet (of the facility of the Computer with internet (of the facility of the Computer with internet (of the facility of the Computer Williams) (of the facility of the facility o 134737 1,13536 2,9334 5,511,31 6,7536 (386)6 1/32/9 23658 1/42/0 426/0 1907 1910 1908 18657 18638 18637 18637 - 45928 1878 9 33 58 534 7 5 2.86 nd March 31 2002 and March 31 2002

ny Obligatore and Steatswee Requirements | Regulations, 2015 pany's watcate at www.co.pd.com and the Stock Exchange's No

### MAXIMUS INTERNATIONAL LIMITED

Increase in Sales

Date: May 25, 2021

Increase in EBITA



Increase in PAT



#### EXTRACT OF STATEMENT OF CONSOLIDATED AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31ST MARCH, 2023

In the	Petones	CONTRIBUTE				
		DESCRIPTION OF THE PARTY OF THE		FEMALINOES		
		21.65.3500 (Audited)	\$1.52,2023 (Saxueltus)	(Author)	31.88.7626 (Author)	(Audited)
T	Total Insures there operations (Not)	2,344.78	2,478.02	1,319,47	HL128.14	1342.11
I	Bid PerM I (Loss for the period Birther for, Exceptional peri) or Exceptionary Meriod	345.14	175.54	708.00	798.09	515.21
B	Bef Picht ( Loss), for the period better the jetter Experience and/or Exhapseince storms	345.14	179.54	193.63	79619	513.01
4	Het MoNt? Local for the period after tax fafter Exceptional and/or Extraordistary Normal	18266	102.64	187,48	238.78	498.33
2	Total Comprehensive Income for the parient	719.47	174.22	109.12	779.49	504.91
6	Equity Share Copine Print Value (1) - per share)	1257.98	1,257.28	1,257.08	1,257.29	1,257,21
T	Pleasures (moduling Pleaskofter Reporter) at cleaner in the Auditor Hagnes Street of the previous a year		-		1988.01	DOM
	Eurologic Per Equity Disars on net profit after too (field, political equity share of \$14- equity				0	
	1.5mm gh	3.11	8.14	9.10	135	834
	To the state of th			20.00	7,100	-

Marco.  1. Pay numbers of Audited Constance Financial Results								
	Falcdes	THEM.INE						
Bi.		QUARTER DIGID			MONA ENDER			
		25.00.2923 (Audited)	35.12.2922 121au/85eb)	31.81.2022 (Auditor)	31.60.2025 (Auditud)	91,01,2932 (Audited)		
1	Turners (Reviews Fore specific ra)	5433	95.42	19.57	1785.21	42333		
1	Perit Retire for	(14.29)	16.20	117,316	88.16	(20.78)		
1	Partition for	(11.85)	16.86	(17.21)	\$1.46	(38.47)		



saged sone









HIST-FR

un fra mai wh. p

